

૨ થિષલનીકિનઃ પત્રં

^I પૌલઃ સિલ્વાનસ્તીમથિયશ્ચેતિનામાનો વયમ્ અસ્મદીયતાતમ્ ઈશ્વરં પ્રભું યીશુખ્રીષ્ટઆશ્રિતાં થિષલનીકિનાં સમિતિં પ્રતિ પત્રં લિખામઃ।

^{II} અસ્માકં તાત ઈશ્વરઃ પ્રભુ યીશુખ્રીષ્ટશ્ચ યુષ્માસ્વનુગ્રહં શાન્તિઞ્ચ ક્રિયાસ્તાં।

^{III} હે ભ્રાતરઃ, યુષ્માકં કૃતે સર્વદા યથાયોગ્યમ્ ઈશ્વરસ્ય ધન્યવાદો ડસ્માભિઃ કર્તવ્યઃ, યતો હેતો યુષ્માકં વિશ્વાસ ઉત્તરોત્તરં વર્દ્યતે પરસ્પરમ્ એકેકસ્ય પ્રેમ ય બહુફલં ભવતિ।

^{IV} તસ્માદ્ યુષ્માભિ યાવન્ત ઉપદ્રવકલેશાઃ સઘન્તે તેષુ યદ્ ધૈર્યં યશ્ચ વિશ્વાસઃ પ્રકાશ્યતે તત્કારણાદ્ વયમ્ ઈશ્વરીયસમિતિષુ યુષ્માભિઃ શ્લાઘામહે।

^V તસ્યેશ્વરસ્ય ન્યાયવિચારસ્ય પ્રમાણં ભવતિ યતો યૂયં યસ્ય કૃતે દુઃખં સહધ્વં તસ્યેશ્વરીયરાજ્યસ્ય યોગ્યા ભવથા।

^{VI} યતઃ સ્વકીયસ્વર્ગદૂતાનાં બલૈઃ સહિતસ્ય પ્રભો રીશોઃ સ્વર્ગાદ્ આગમનકાલે યુષ્માકં કલેશકેભ્યઃ કલેશેન ફલદાનં સાર્દ્ધમસ્માભિશ્ચ

^{VII} ક્લિશ્યમાનેભ્યો યુષ્મભ્યં શાન્તિદાનમ્ ઈશ્વરેણ ન્યાયં ભોત્સ્યતે;

^{VIII} તદાનીમ્ ઈશ્વરાનભિજ્ઞેભ્યો ડસ્મત્પ્રભો રીશુખ્રીષ્ટસ્ય સુસંવાદાગ્રાહકેભ્યશ્ચ લોકેભ્યો જાજ્વલ્યમાનેન વહ્નિના સમુચિતં ફલં યીશુના દાસ્યતે;

^{IX} તે ય પ્રભો વર્દનાત્ પરાક્રમયુક્તવિભવાચ્ચ સદાતનવિનાશરૂપં દણ્ડં લપ્સ્યન્તે,

^X કિન્તુ તસ્મિન્ દિને સ્વકીયપવિત્રલોકેષુ વિરાજિતું યુષ્માન્ અપરાંશ્ચ સર્વાન્ વિશ્વાસિલોકાન્ વિસ્માપયિતુઞ્ચ સ આગમિષ્યતિ યતો ડસ્માકં પ્રમાણો યુષ્માભિ વિશ્વાસોડકારિ।

^{XI} અતોડસ્માકમ્ ઈશ્વરો યુષ્માન્ તસ્યાહ્વાનસ્ય યોગ્યાન્ કરોતુ સૌજન્યસ્ય શુભફલં વિશ્વાસસ્ય ગુણઞ્ચ પરાક્રમેણ સાધયત્વિતિ પ્રાર્થનાસ્માભિઃ સર્વદા યુષ્મન્નિમિત્તં ક્રિયતે,

XII યતસ્તથા સત્યસ્માકમ્ ઈશ્વરસ્ય પ્રભો યીશુખ્રીષ્ટસ્ય ચાનુગ્રહાદ્ અસ્મત્પ્રભો યીશુખ્રીષ્ટસ્ય નામ્નો ગૌરવં યુષ્માસુ યુષ્માકમપિ ગૌરવં તસ્મિન્ પ્રકાશિષ્યતે।

II

I હે ભ્રાતરઃ, અસ્માકં પ્રભો યીશુખ્રીષ્ટસ્યાગમનં તસ્ય સમીપે ડસ્માકં સંસ્થિતિઞ્ચાધિ વયં યુષ્માન્ ઇદં પ્રાર્થયામહે,

II પ્રભેસ્તદ્ દિનં પ્રાયેણોપસ્થિતમ્ ઇતિ યદિ કશ્ચિદ્ આત્મના વાચા વા પત્રેણ વાસ્માકમ્ આદેશં કલ્પયન્ યુષ્માન્ ગદતિ તર્હિ યૂયં તેન યઞ્ચલમનસ ઉદ્વિગ્નાશ્ચ ન ભવત।

III કેનાપિ પ્રકારેણ કોડપિ યુષ્માન્ ન વઞ્ચયતુ યતસ્તસ્માદ્ દિનાત્ પૂર્વ્વ ધર્મ્મલોપેનોપસ્યાતવ્યં,

IV યશ્ચ જનો વિપક્ષતાં કુર્વન્ સર્વ્વસ્માદ્ દેવાત્ પૂજનીયવસ્તુશ્ચોત્રંસ્યતે સ્વમ્ ઈશ્વરમિવ દર્શયન્ ઈશ્વરવદ્ ઈશ્વરસ્ય મન્દિર ઉપવેક્ષ્યતિ ચ તેન વિનાશપાત્રેણ પાપપુરુષેણોદેતવ્યં।

V યદાહં યુષ્માકં સન્નિધાવાસં તદાનીમ્ એતદ્ અકથયમિતિ યૂયં કિં ન સ્મરથ?

VI સામ્પ્રતં સ ચેન નિવાર્યતે તદ્ યૂયં જાનીથ, કિન્તુ સ્વસમયે તેનોદેતવ્યં।

VII વિધર્મ્મસ્ય નિગૂઢો ગુણ ઇદાનીમપિ ફલતિ કિન્તુ યસ્તં નિવારયતિ સોડદાપિ દૂરીકૃતો નાભવત્।

VIII તસ્મિન્ દૂરીકૃતે સ વિધર્મ્મ્યુદેષ્યતિ કિન્તુ પ્રભુ યીશુઃ સ્વમુખપવનેન તં વિધ્વંસયિષ્યતિ નિજોપસ્થિતેસ્તેજસા વિનાશયિષ્યતિ ચ।

IX શયતાનસ્ય શક્તિપ્રકાશનાદ્ વિનાશ્યમાનાનાં મધ્યે સર્વ્વવિધાઃ પરાક્રમા ભ્રમિકા આશ્ચર્યક્રિયા લક્ષણાન્યધર્મ્મજાતા સર્વ્વવિધપ્રતારણા ચ તસ્યોપસ્થિતેઃ ફલં ભવિષ્યતિ;

X યતો હેતોસ્તે પરિત્રાણપ્રાપ્તયે સત્યધર્મ્મસ્યાનુરાગં ન ગૃહીતવન્તસ્તસ્માત્ કારણાદ્

XI ઈશ્વરેણ તાન્ પ્રતિ ભ્રાન્તિકરમાયાયાં પ્રેષિતાયાં તે મૃષાવાક્યે વિશ્વસિષ્યન્તિ।

XII યતો યાવન્તો માનવાઃ સત્યધર્મો ન વિશ્વસ્યાધર્મોણ તુષ્યન્તિ તૈઃ સર્વે દૃણ્ડભાજનૈર્ભવિતવ્યં।

XIII હે પ્રભોઃ પ્રિયા ભ્રાતરઃ, યુષ્માકં કૃત ઈશ્વરસ્ય ધન્યવાદોડસ્માભિઃ સર્વદા કર્તવ્યો યત ઈશ્વર આ પ્રથમાદ્ આત્મનઃ પાવનેન સત્યધર્મો વિશ્વાસેન ચ પરિત્રાણાર્થં યુષ્માન્ વરીતવાન્

XIV તદર્થજ્ઞાસ્માભિ ધોષિતેન સુસંવાદેન યુષ્માન્ આહૂયાસ્માકં પ્રભો યીશુખ્રીષ્ટસ્ય તેજસોડધિકારિણઃ કરિષ્યતિ।

XV અતો હે ભ્રાતરઃ યૂયમ્ અસ્માકં વાક્યૈઃ પત્રૈશ્ચ યાં શિક્ષાં લબ્ધવન્તસ્તાં કૃત્સ્નાં શિક્ષાં ધારયન્તઃ સુસ્થિરા ભવતા।

XVI અસ્માકં પ્રભુ યીશુખ્રીષ્ટસ્તાત ઈશ્વરશ્ચાર્થતો યો યુષ્માસુ પ્રેમ કૃતવાન્ નિત્યાજ્ઞ સાન્ત્વનામ્ અનુગ્રહેણોત્તમપ્રત્યાશાજ્ઞ યુષ્મભ્યં દત્તવાન્

XVII સ સ્વયં યુષ્માકમ્ અન્તઃકરણાનિ સાન્ત્વયતુ સર્વસ્મિન્ સદ્ધાક્યે સત્કર્મ્મણિ ચ સુસ્થિરીકરોતુ યા।

III

I હે ભ્રાતરઃ, શેષે વદામિ, યૂયમ્ અસ્મભ્યમિદં પ્રાર્થયધ્વં યત્ પ્રભો વાક્યં યુષ્માકં મધ્યે યથા તથૈવાન્યત્રાપિ પ્રયરેત્ માન્યજ્ઞ ભવેત્;

II યસ્ય વયમ્ અવિવેચકેભ્યો દુષ્ટેભ્યશ્ચ લોકેભ્યો રક્ષાં પ્રાપ્નુયામ યતઃ સર્વેષાં વિશ્વાસો ન ભવતિ।

III કિન્તુ પ્રભુ વિશ્વાસ્યઃ સ એવ યુષ્માન્ સ્થિરીકરિષ્યતિ દુષ્ટસ્ય કરાદ્ ઉદ્ધરિષ્યતિ ચ।

IV યૂયમ્ અસ્માભિ ર્યદ્ આદિશ્યધ્વે તત્ કુરુથ કરિષ્યથ ચેતિ વિશ્વાસો યુષ્માનધિ પ્રભુનાસ્માકં જાયતો।

V ઈશ્વરસ્ય પ્રેમ્નિ ખ્રીષ્ટસ્ય સહિષ્ણુતાયાજ્ઞ પ્રભુઃ સ્વયં યુષ્માકમ્ અન્તઃકરણાનિ વિનયતુ।

VI હે ભ્રાતરઃ, અસ્મત્પ્રભો યીશુખ્રીષ્ટસ્ય નામ્ના વયં યુષ્માન્ ઇદમ્ આદિશામઃ, અસ્મત્તો યુષ્માભિ ર્યા શિક્ષલમ્મિ તાં વિહાય કશ્ચિદ્ ભ્રાતા યદ્યવિહિતાચારં કરોતિ તર્હિ યૂયં તસ્માત્ પૃથગ્ ભવતા।

VII યતો વયં યુષ્માભિઃ કથમ્ અનુકર્તવ્યાસ્તદ્ યૂયં સ્વયં જાનીથા યુષ્માકં મધ્યે વયમ્ અવિહિતાચારિણો નાભવામ,

VIII વિનામૂલ્યં કસ્યાપ્યન્નં નાભુંજમહિ કિન્તુ કોડપિ યદ્ અસ્માભિ ભારિગ્રસ્તો ન ભવેત્ તદર્થં શ્રમેણ કલેશેન ચ દિવાનિશં કાર્યમ્ અકુર્મ્મી

IX અત્રાસ્માકમ્ અધિકારો નાસ્તીત્યં નહિ કિન્ત્વસ્માકમ્ અનુકરણાય યુષ્માન્ દૃષ્ટાન્તં દર્શયિતુમ્ ઇચ્છન્તસ્તદ્ અકુર્મ્મી

X યતો યેન કાર્યં ન ક્રિયતે તેનાહારોડપિ ન ક્રિયતામિતિ વયં યુષ્મત્સમીપ ઉપસ્થિતિકાલેડપિ યુષ્માન્ આદિશામ

XI યુષ્મન્મધ્યે ડવિહિતાચારિણઃ કેડપિ જના વિદ્યન્તે તે ચ કાર્યમ્ અકુર્વન્ત આલસ્યમ્ આચરન્તીત્યસ્માભિઃ શ્રૂયતે

XII તાદૃશાન્ લોકાન્ અસ્મતપ્રભો રીશુખ્રીષ્ટસ્ય નામ્ના વયમ્ ઇદમ્ આદિશામ આજ્ઞાપયામશ્ચ, તે શાન્તભાવેન કાર્યં કુર્વન્તઃ સ્વકીયમન્નં ભુક્ષતાં

XIII અપરં હે ભ્રાતરઃ, યૂયં સદાચરણે ન કલામ્યતા

XIV યદિ ચ કશ્ચિદેતત્પત્રે લિખિતામ્ અસ્માકમ્ આજ્ઞાં ન ગૃહ્ણાતિ તર્હિ યૂયં તં માનુષં લક્ષયત તસ્ય સંસર્ગં ત્યજત ચ તેન સ ત્રપિષ્યતે

XV કિન્તુ તં ન શત્રું મન્યમાના ભ્રાતરમિવ ચેતયતા

XVI શાન્તિદાતા પ્રભુઃ સર્વત્ર સર્વથા યુષ્મભ્યં શાન્તિં દેયાત્ પ્રભુ યુષ્માકં સર્વેષાં સફી ભૂયાત્

XVII નમસ્કાર એષ પૌલસ્ય મમ કરેણ લિખિતોડભૂત્ સર્વસ્મિન્ પત્ર એતન્મમ ચિહ્નમ્ એતાદૃશૈરક્ષરૈર્મયા લિખ્યતે

XVIII અસ્માકં પ્રભો રીશુખ્રીષ્ટસ્યાનુગ્રહઃ સર્વેષુ યુષ્માસુ ભૂયાત્ આમેન્

Sanskrit Bible (NT) in Gujarati Script New Testament in Sanskrit Language; printed in Gujarati Script

copyright © 2018 SanskritBible.in

Language: Sanskrit

Contributor: SanskritBible.in

Thank you for your interest in Sanskrit Bible.

Sanskrit Bible (NT) is freely available in 22 different scripts of your choice. This edition is in Gujarati script and is based on the Sanskrit translation of the Holy Bible published by Calcutta Baptist Missionaries in 1851. Please visit SanskritBible.in to learn more about Sanskrit Bible and to download various free Christian literature.

This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0.

You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:

You include the above copyright and source information.

If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.

If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.

Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners.

Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.

2020-01-01

PDF generated using Haiola and XeLaTeX on 11 Nov 2022 from source files dated 29 Jan 2022

e1290797-4477-53f0-873d-c9153a72fd01